



Azadi Ka  
Amrit Mahotsav

જા.નં./મા-૨/પરચ/૨૦૨૨/ 105/૯

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,  
ઓ/૩, જિલ્લા સેવા સદન-૨,  
અઠવાલાઈન્સ, સુરત

Web : suratdeo.org

Email : suratdeo@gmail.com

તા. ૨૭ /૦૭/૨૦૨૨

પ્રતિ,

આચાર્યશ્રી,

સુરત જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તરફ

જેલમાં સજા ભોગવતા શાળામાં અભ્યાસ કરતા બંદીવાનો નાં બાળકોને શૈક્ષણિક સવલતો  
આપવા બાબતે મે, સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી (માધ્યમિક) કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરના પત્ર  
ક્રમાંક/માધ્ય /મા-૨/ફરચદ/૨૦૨૨/૧૧૪૫૦-૮૪ તા. ૧૧/૦૭/૨૦૨૨ ની જાણ તથા અમલ થવા સારું

જિલ્લા શિક્ષણાધિકારી  
સુરત, જિલ્લા-સુરત

## કામચાનર શાળાઓના કચેરા

બ્લોક નં. ૯/૧, ડૉ. જીવરાજ મહેતા ભવન,  
ગુ.રા., ગાંધીનગર-૩૮૨૦૧૦. ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૦૧૧.

ક્રમાંક: માધ્ય/મા-૨/ફર્યદ/૨૦૨૨/૧૧૪૫૦-૮૪.

તા.૧૧-૦૭-૨૦૨૨

પ્રતિ

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,

જિલ્લા : તમામ, ગુજરાત રાજ્ય.

**વિષય:** જેલમાં સજા ભોગવતા શાળામાં અભ્યાસ કરતા બંદીવાનોના બાળકોને શૈક્ષણિક સવલતો આપવા બાબત.

**સંદર્ભ:** અધિક્ષકશ્રી, અમદાવાદ મધ્યસ્થ જેલના તા.૦૮/૦૬/૨૦૨૧ ના પત્ર-ક્રમાંક: વેલ્ફેર/૨૧૮/૨૦૨૨.

શ્રીમાન/શ્રીમતિ,

ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની જુદી-જુદી જેલો ખાતે કુટુંબના જવાબદાર વ્યક્તિ જેલમાં આવી જતા તેઓનું કુટુંબ આર્થિક રીતે ગરીબીમાં આવી જાય છે. તેથી જેલ ખાતે સજા ભોગવતા કેદીભાઈઓના બાળકોને સ્કુલ એડમિશન, શૈક્ષણિક ફી, સ્કોલરશીપ, સુનિફોર્મ, પાઠ્યપુસ્તકો, નોટબુકો તથા અન્ય શૈક્ષણિક જરૂરીયાતો તેમજ સરકારશ્રીની જુદી-જુદી શૈક્ષણિક યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની હોવાનું નામ.હાઈકોર્ટે ફિમિનલ મીસે. એપ્લીકેશન નં. ૪૬૭૫/૨૦૦૪ ઈન ફિમી.અપીલ ૯૯/૨૦૦૦ ના નામ.ગુજરાત હાઈકોર્ટનો તા.૨૮/૦૭/૨૦૦૪ નો ઓરલ ઓર્ડરથી માર્ગદર્શન આપેલ છે.

જેના અનુસંધાને શિક્ષણ વિભાગના તા.૧૯/૦૨/૨૦૦૫ ના પરિપત્ર-ક્રમાંક: પીઆરઈ/૧૧૦૪/સીસી/૭૦૫/ક થી નીચે મુજબ સૂચનાઓ કરેલ છે;

".....પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુ. જાતિ/અનુ. જનજાતિ અને પછાત વર્ગના બાળકોને અભ્યાસ દરમિયાન ગણવેશ, પાઠ્યપુસ્તકો/નોટબુકો પુરાં પાડવાં, શાળાકીય ફી (સ્કોલરશીપ) વગેરે શૈક્ષણિક સવલતો આપવા અંગેની જુદી જુદી યોજનાઓ સરકારશ્રીએ અમલમાં મુકી છે. તેથી આવા વર્ગના અન્ય બાળકોની જેમ જેલના કેદીઓના પાત્રતા દરવાજા બાળકોને નિયમાનુસાર તેમને મળવાપાત્ર શાળા પ્રવેશ, પાઠ્યપુસ્તકો, નોટબુકો, ગણવેશ, દફતર, શાળાકીય ફી, સ્કોલરશીપ તથા અન્ય તમામ સવલતો નિયત સમયે અને કોઈપણ પૂર્વગ્રહ વગર તાત્કાલિક મળી રહે તેની ખાસ તકેદારી રાખવા સંબંધિત સર્વે અધિકારીઓ, કર્મચારીઓ અને એજન્સીઓને આથી ભાર પૂર્વક સૂચના આપવામાં આવે છે. વધુમાં કેદીઓના બાળકો, અનાથ બાળકો અને વિકલાંગ બાળકોને જ્યાં જરૂર પડે ત્યાં તેમને નિયમાનુસાર મળવાપાત્ર શાળા પ્રવેશ અને અન્ય શૈક્ષણિક સવલતો મેળવવામાં મદદરૂપ થવા માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવે છે.

આ સૂચનાઓનો અનાદર/ઉપેક્ષા/ભંગ કરનાર જવાબદાર અધિકારી/કર્મચારી સામે ખાતાકીય રહે પગલાં લેવામાં આવશે તેની જાણ સંબંધિત સર્વેને નોંધ લેવા જણાવવામાં આવે છે. જેલ સત્તાવાળાઓએ

૪૪૭

મા-૪

૧૧/૭

Others from 2022 doc


કેદીઓના બાળકોની સ્વચંરૂપષ્ટ માહિતી જે તે સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓને સમયસર પહોંચાડવાની રહેશે. ”

આ સંદર્ભે અધિક્ષકશ્રીના ઉક્ત તા.૦૮/૦૬/૨૦૨૨ ના પત્રમાં જણાવ્યા અનુસાર દર વર્ષે કેદીઓના ભણતા બાળકોની વિગતવાર માહિતી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને મોકલી આપવામાં આવતી હોવા છતાં તેનો પુરતો અમલ ન થતો હોવાનું જણાવેલ છે. જે ખુબ ગંભીર બાબત ગણી શકાય.

આથી, આ પત્રની સાથે બિડાણમાં શાળામાં અભ્યાસ કરતા બંદીવાનોના બાળકોની યાદી અને શિક્ષણ વિભાગના પરિપત્રની નકલ આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. જેને ધ્યાને લઈ આપના સંબંધિત જેલ અધિક્ષકશ્રીઓ/જેલરોશ્રીઓને પરામર્શમાં રહીને સત્વરે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવે છે.

હવે પછી આ સંદર્ભે સંબંધિત કચેરીના પરસ્પર સહકારમાં રહી નિયમોનુસારની સમયસર કાર્યવાહી થાય તે વધુ ઈચ્છનીય છે.


બિડાણ : ઉપર મુજબ.

  
સંયુક્ત શિક્ષણ નિયામક  
માધ્યમિક  
ગુ.રા. ગાંધીનગર.

નકલ સવિનય રવાના :-

- અધિક્ષકશ્રી, અધિક્ષકશ્રીની કચેરી, અમદાવાદ મધ્યસ્થ જેલ, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૨૭.





જાવક નં: વેલ્ફેર/૨૨૮/૨૦૨૨  
અધિક્ષકશ્રીની કચેરી,  
અમદાવાદ મધ્યસ્થ જેલ,  
સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૨૭  
Email: sp-jail-ahd@gujarat.gov.in  
ફોન નં. (૦૭૯) ૨૭૫૨ ૧૬૯૨  
ફેક્સ નં. (૦૭૯) ૨૭૫૨ ૨૧૩  
તા. ૦૮/૦૬/૨૦૨૨

પ્રતિ,

(૧) નાયબ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,

ગુજરાત રાજ્ય, બ્લોક નં-૧૨, ૧લો માળ,

ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

(૨) કમિશ્નરશ્રી,

શાળાઓની કચેરી, (માધ્યમિક) ગુજરાત રાજ્ય, બ્લોક નં-૯, ૧લો માળ,

ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

વિષય: જેલમાં સજા ભોગવતા શાળામાં અભ્યાસ કરતા બંદીવાનોના બાળકોને  
શૈક્ષણિક સવલતો આપવા બાબત.

સંદર્ભ: (૧) કિમી, મીસે.એપ્લી નં. ૪૬૭૫/૨૦૦૪ ઇન કિમી.અપીલ નં.૯૯/૨૦૦૦  
નો નામ.ગુજ.હાઇકોર્ટનો તા-૨૮/૦૭/૨૦૦૪ નો ઓરલ ઓર્ડર.

(૨) ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક  
પીઆરઇ/૧૧૦૪/ સીસી/૭૦૫/ક તા - ૧૯/૦૨/૨૦૦૫

સાહેબશ્રી,

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યની જુદી-જુદી જેલો ખાતે કુટુંબનાં જવાબદાર વ્યક્તિ જેલમાં  
આવી જતા તેઓનું કુટુંબ આર્થિક રીતે ગરીબીમાં આવી જાય છે. તેથી તેઓ દ્વારા વારંવાર બાળકોનાં શૈક્ષણિક હેતુ માટે  
રજાની માંગણી કરવામાં આવે છે. જેલ ખાતે સજા ભોગવતા કેદીભાઈઓના બાળકોને સ્કુલ એડમિશન, શૈક્ષણિક ફી,  
સ્કોલરશીપ, યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો, નોટબુકો, તથા અન્ય શૈક્ષણિક જરૂરિયાતો તેમજ સરકારશ્રીની જુદી-જુદી શૈક્ષણિક  
યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની હોવાનું નામ.ગુજ.હાઇકોર્ટએ સંદર્ભ-૧ થી ઓરલ  
ઓર્ડરમાં માર્ગદર્શન આપેલ છે. સંદર્ભ-૨ અનુસાર ગુજરાત સરકારશ્રી, શિક્ષણ વિભાગનાં ઠરાવમાં જણાવ્યા મુજબ સંબંધિત  
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ/જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીશ્રીઓ/શાસનાધિકારીશ્રીઓને જેલમાં સજા ભોગવતા  
કેદીઓના બાળકોને તમામ શૈક્ષણિક સવલતો પુરી પાડવાની ખાસ સુચના આપવામાં આવેલ છે.

બંદીવાનો પોતાના બાળકોને શિક્ષણ અપાવવાના હેતુસર નામ.ગુજ.હાઇકોર્ટમાં વારંવાર જામિન રજા અરજીઓ  
કરતા હોય છે ત્યારે નામ.ગુજ.હાઇકોર્ટ તરફથી શિક્ષણના પરિપત્રની જોગવાઈ મુજબ બંદીવાનોના શાળામાં અભ્યાસ  
કરતા બાળકોને શિક્ષણને લગતી સવલતો આપવા બાબતે સરકારશ્રી તરફથી કેમ અસરકારક કામગીરી થતી નથી ? તે  
બાબતે જેલ સત્તાવાળાને વારંવાર ઠપકો મળતો હોય . જે બાબત દુઃખદ છે.

અત્રેની જેલ ખાતે દર વર્ષે કેદીઓના ભણતા બાળકોની વિગતવાર માહિતી મોકલી આપવામાં આવે છે. તેમ  
જો તેનો પુરતો અમલ થતો ન હોય આપના ક્ષેત્રાધિકાર હેઠળની સ્કુલોને જરૂરી સુચન / માર્ગદર્શન આપી કેદીઓના  
બાળકોને શૈક્ષણિક સવલતો મળી રહે તેમ ઘટતી કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીની જાણ કરવા વિનંતી.

બિડાણ: કેદીઓના ભણતા બાળકોની યાદી.

(તેજસ વી. પટેલ) IPS  
અધિક્ષક

અમદાવાદ મધ્યસ્થ જેલ